



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ  
છઠ્ઠો માળ, ગિફ્ટ વન, માર્ગ-પ-સી, ઝોન-પ,  
ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫, ગુજરાત

જાહેર નોટીસ

ગુજરાતમાં કાર્યરત મ્યુનિસિપલ ધન કચરા આધારિત ઉર્જા મથકોમાંથી વિતરણ પરવાનેદારો તેમજ અન્ય દ્વારા વિજ પ્રાપ્તિ ના શુલ્ક માટેનો હુકમ નં ૪/૨૦૧૬ તારીખ ૧૦.૧૧.૨૦૧૬ નો સમયગાળો લંબાવવા અંગેની સુઓ-મોટુ કાર્યવાહી હાથ ધરવા બાબતે.

આરોગે ગુજરાતમાં કાર્યરત મ્યુનિસિપલ ધન કચરા આધારિત ઉર્જા મથકોમાંથી પાસેથી મ્યુનિસિપલ ધન કચરા આધારિત ઉર્જા ખરીદવા માટે શુલ્ક નક્કી કરવા માટેના હુકમ નં. ૪/૨૦૧૬ તારીખ ૧૦.૧૧.૨૦૧૬ ના રોજ પસાર કરેલ છે. આ હુકમ નો નિયંત્રણ સમયગાળો ૧૧.૧૦.૨૦૧૬ થી ૩૧.૦૩.૨૦૧૯ છે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એનર્જી પ્રોજેક્ટ ડેવલપર્સ ને તારીખ ૩૧.૦૩.૨૦૧૯ ના રોજ અથવા તે પહેલાં પ્રોજેક્ટને કમિશન કરવામાં તેમજ ટેરિફ (શુલ્ક) અને અન્ય વ્યાપારી મુદ્દાઓની આવશ્યકતાના અનિશ્ચિતતા નો સામનો કરવા અંગે ગુજરાત સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ નો સંપર્ક કર્યો છે. તે અંગે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોગ ને ઉપરોક્ત મુદ્દા ના સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે.

ઉપરોક્ત પ્રક્રિયા ને ધ્યાને લઈ આયોગ દ્વારા આયોગ દ્વારા સુઓ-મોટુ અરજી નં ૧૬૫૪/૨૦૧૭ શરૂ કરાઈ છે. જે આયોગની વેબ સાઇટ ([www.gercin.org](http://www.gercin.org)) ઉપર વાંધા/સૂચનો મંગાવવા અર્થે મુકવામાં આવે છે. ઉપરની સુઓ-મોટુ અરજી સંબંધમાં જેમને તેમના વાંધા/સૂચનો રજૂ કરવામાં રસ હોય તેવી વ્યક્તિઓ, તેઓ જેના પર આધાર રાખવા માગતા હોય તેમને આથી જાણ કરવામાં આવે છે કે ઉપરની સુઓ-મોટુ અરજીના સંબંધમાં જેમને તેમના વાંધા/સૂચનો રજૂ કરવામાં રસ હોય તેવી વ્યક્તિઓ, તેઓ જેના પર આધાર રાખવા માગતા હોય તે એફિડેવિટથી યોગ્ય રીતે સમર્થિત દસ્તાવેજોની પાંચ નકલ સાથે સાથે તા. ૩૦/૦૬/૨૦૧૭ પહેલાં સચિવશ્રી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છઠ્ઠો માળ, ગિફ્ટ વન, માર્ગ-પ-સી, ઝોન-પ, ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૦૩૫૫, ગુજરાતને રજૂ કરી શકશે અને તેઓને રૂબરૂમાં સાંભળે તેમ તેઓ ઇચ્છે કે કેમ તે પણ તેમાં દર્શાવે. સુઓ-મોટુ અરજી નં. ૧૬૫૪/૨૦૧૭ માટેની સુનાવણીની તારીખ ૦૭/૦૭/૨૦૧૭ના રોજ ૧૧:૩૦ વાગ્યે નક્કી કરી છે.

સહી/-

(રૂપવંત સિંહ, આઇ.એ.એસ)

સચિવ

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૬/૦૬/૨૦૧૭.